

ROBERT RESOURCES LIMITED

CIN: - L99999GJ1982PLC096012

REGD. OFF: - OFFICE NO 214, SECOND FLOOR, EVA-SURBHI COMMERCIAL COMPLEX,
BHAVNAGAR BPTI, BHAVNAGAR-364002, GUJARAT, Contact No: +91- 6358905872

Email: - robertresourceslimited@gmail.com Website: - www.robertresources.com

Date: **2nd June, 2025**

<p>To, MSEI Ltd. Vibgyor Towers, 4th Floor, Plot No. C 62, G- Block, Opp. Trident Hotel, BandraKurla Complex, Bandra (E), Mumbai – 400 098</p>	<p>To, THE CULCUTTA STOCK EXCHANGE LIMITED 7, Lyons Range, Dalhousie, Kolkata-700001, West Bengal</p>
---	---

Sub: Newspaper Publication – Standalone and Consolidated Audited Financial Results for the quarter and year ended March 31, 2025

Dear Sir/Ma'am,

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended please find enclosed copies of Extract of Standalone and Consolidated Audited Financial Results for the quarter and year ended March 31, 2025 as published in English daily “WESTERN TIMES, AHMEDABAD” and in Gujarati (Local) daily “WESTERN TIMES, AHMEDABAD” both newspapers dated 1st June, 2025.

Kindly take the information on your records.

Thanking you,

Yours Faithfully,

FOR, ROBERT RESOURCES LIMITED

Jimit Dilipbhai Patel

Digitally signed by Amit Dilipbhai Patel
DN: c=IN, o=Personal, title=S16,
pseudoName=133338298156118084966f6eM2m3dUTUSF,
2.5.4.20=e849c2f27f01c2ef15c720dc6ad637233e1a16bf8fc
6f51fa9a20beff21a276, postalCode=364001, st=Gujarat,
serialNumber=C50d014809f7fe1d720dc6f12127df8de54fed
8db0f7553a179059718df8d63a3, cn=Amit Dilipbhai Patel
Date: 2023.06.12 11:09:41 +05'30'

MANAGING DIRECTOR
JIMTIBHAI PATEL
DIN: 10309343

MSMEs hold the key towards becoming a Viksit Bharat

New Delhi, May 31 (IANS) Micro, small and medium enterprises (MSMEs) are the key towards becoming a Viksit Bharat by 2047, and it is the right time to speak about industry and MSME collaboration to celebrate their contribution to India's aspirations, a top government official has stressed.

India, in its aspiration, has been constantly growing, from being the 10th largest economy 10 years ago to currently the 4th largest economy.

According to Dr Raneesh, Additional Secretary, Ministry of MSMEs, through vendor development pro-

grammes, technology upgradation, transfer of technologies, and integration of MSMEs in supply chain, we can create an opportunity that is a win-win situation for players on both sides of the collaboration, as MSMEs get an opportunity to grow and industry gets an opportunity to source their requirements domestically with emphasis on Atmanirbhar Bharat and a Viksit Bharat.

Dr Raneesh launched the 'CII MSME Export Helpdesk', during 'CII Annual Business Summit 2025' expressing optimism for its role in scaling MSMEs to drive competitiveness and productivity.

SEBI confirms ban on LS Industries and key individuals amid fraud probe

Mumbai, May 31 (IANS) The Securities and Exchange Board of India (SEBI) has confirmed the suspension of LS Industries, its promoter Profund HUF, its promoter Profund HUF, and four other individuals from participating in the securities markets.

The action comes as part of an ongoing investigation into alleged fraudulent activities and manipulation of the company's share price.

The individuals barred include Jahangir Pani-

kkaveetil Perumbarambathu, the promoter of Profund Finance, as well as Suresh Goyal, Akha Sahni, and Shashi Kant Sahni HUF, a Dubai-based NRI Finance, and four other individuals from participating in the securities markets.

SEBI has extended the deadline for completing the investigation until November 15 and has directed all involved parties to cooperate fully with the inquiry.

Back in February 2025, SEBI had issued an inter-

India-Chile economic pact to boost global value chains

New Delhi, May 31 (IANS) The India-Chile Comprehensive Economic Partnership Agreement (CEPA) will pave the way for a deeper economic partnership and the creation of strengthened global value chains between the two countries, the government has said.

The CEPA aims to unlock the full potential of the trade and commercial relationship between India and Chile, boosting employment, bilateral trade, and economic growth.

The modalities of negotiation will emerge through stakeholder consultations and industry feedback. Both sides are committed to a gainful and explorative approach to ensure a successful and

meaningful agreement, said the Commerce Ministry.

In furtherance of the commitment made during the high-level dialogue between India and Chile, the terms of reference for negotiating the CEPA were signed earlier this month.

The first round of negotiations commenced on May 26, with the opening ceremony inaugurated by Commerce Secretary, Sunil Barthwal in the presence of Ambassador of Chile to India, Juan Angulo. The next round of negotiations is expected in July or August and will be preceded by inter-session discussions through virtual conferences to address outstanding issues in advance of the upcoming meeting.

The launch of the CEPA negotiations was welcomed by both nations during the state visit of the President of Chile, Gabriel Boric Font, to India in April and his meeting with Prime Minister Narendra Modi. The Chilean President conveyed that India is a priority partner for Chile in the global economy and highlighted the need to explore strategies for enhanced and diversified trade between the two countries. Both leaders welcomed the initiation of negotiations towards a balanced, ambitious, comprehensive, and mutually beneficial CEPA aimed at achieving deeper economic integration.

The Chilean negotiat-

ing team had 17 delegates and the Indian delegation was headed by Chief Negotiator Vimal Anand, Joint Secretary, Department of Commerce.

Discussions were held across 17 themes including Trade in Goods, Trade in Services, Movement of Natural Persons, Rules of Origin, Sanitary and Phytosanitary Measures, Technical Barriers to Trade, Customs Procedures and Trade Facilitation, Initial Provisions and General Definitions, Core and Institutional Provisions, Final Provisions, Transparency, Dispute Settlement, Economic Cooperation, MSMEs and Women's Economic Empowerment, among others.

—IANS

ing team had 17 delegates and the Indian delegation was headed by Chief Negotiator Vimal Anand, Joint Secretary, Department of Commerce.

Discussions were held across 17 themes including Trade in Goods, Trade in Services, Movement of Natural Persons, Rules of Origin, Sanitary and Phytosanitary Measures, Technical Barriers to Trade, Customs Procedures and Trade Facilitation, Initial Provisions and General Definitions, Core and Institutional Provisions, Final Provisions, Transparency, Dispute Settlement, Economic Cooperation, MSMEs and Women's Economic Empowerment, among others.

—IANS

CHANGE OF NAME	CHANGE OF NAME
I have changed my minor son's old name from BHAGYA VIBULBHAI PATEL to new name BHAGYA VIKULBHAI PATEL. Add: 16, Ghanashyamnagar Soc. At: Kunda Tal Kadi Dist. Mehsana 863	I have changed my old name from RAMESHCHANDRA LILADHAR SOLANKI to new name SOLANKI RAMESHBHAI LILADHARBHAI Add: D-500, Borsali Apartment, Near Cama Hotel Khandpur, Ahmedabad-380001 862

Ambal Sarabhai Enterprises Limited
Registered Office: Shahi Nizami, Mirzapur Road, Ahmedabad-380 001
CIN: L52100GJ1978PLC003159 BSE Scrip code: 500009,
Website: www.ase.life E-mail: dcp@ase.life

STATEMENT OF AUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2025

The Board of Directors of the Company, at its meeting held on May 30, 2025, approved the audit Standalone and Consolidated financial results of the Company for the quarter and year ended March 31, 2025.

The full financial results of the Company along with Auditor's Report, are available on the Stock Exchange's website www.bseindia.com and are also posted on the Company's website at www.ase.life which can be accessed by scanning the quick response (QR) code given below.

Date: 31.05.2025
Place: Vadodra

For: Ambal Sarabhai Enterprises Limited
Sd/-
Kartikya V. Sarabhai (Chairman)

CHANGE OF NAME
I Vinabeh Kuldeep Singh Dodiya have changed my minor child's name from OLD DODIYA SAMRATH KULDEEPSINH to NEW DODIYA SAMRATH KULDEEPSINH Add: 32, YASHASWEE BUNGLOWS, BERNARA ROAD, NEAR FAITH SCHOOL, HIMATNAGAR, DIST. SABARKANTHA, GUJARAT

Date: 31.05.2025
Place: Vadodra

For: Ambal Sarabhai Enterprises Limited
Sd/-
Kartikya V. Sarabhai (Chairman)

ROBERT RESOURCES LIMITED
CIN: L99999GJ1982PLC096012

REGD. OFF: OFFICE NO 214, SECOND FLOOR, EVA-SURBHI COMMERCIAL COMPLEX, BHAVNAGAR BPTI, BHAVNAGAR-364002, GUJARAT, Contact No: +91 - 6358905872
Email: robertresourceslimited@gmail.com Website: www.robertresources.com

Extract of Standalone and Consolidated Audited Financial Results for the Quarter and year ended on 31st March, 2025
(Rs. In Lakhs)

S. No.	Particular	Standalone		Consolidated	
		Quarter ended 31/03/2025	Year ended 31/03/2025	Quarter ended 31/03/2025	Year ended 31/03/2025
1.	Total income from operations (net)	47.70	152.10	130.77	309.93
2.	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	(118.53)	(37.03)	39.20	(113.73)
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(118.53)	(37.03)	39.20	(113.73)
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(67.30)	(72.72)	23.86	(91.00)
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	64.28	139.47	39.25	(15.00)
6.	Equity Share Capital	1024.50	1024.50	1024.50	1024.50
7.	Other Equity	798.34	798.34	798.34	798.34
8.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -				
1. Basic		(0.66)	(0.71)	0.23	(0.89)
2. Diluted		(0.66)	(0.71)	0.23	(0.89)

Notes:

- The above standalone and consolidated audited financial results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors of the Company in their respective meetings held on May 30, 2025. The audit is required under Regulations 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the statutory auditors of the company.
- The standalone and consolidated audited financial results for the quarter and year ended March 31, 2025 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies engaged in the company.
- The company was in receipt of Interim Order from the Securities and Exchange Board of India ("SEBI") alleging non-compliance of provisions pertaining to wrongful gains transactions, the Company had consulted an independent law firm, and in its reply to SEBI, the Company has denied the charges in its entirety, inter alia, on the basis that these transactions are in full compliance with the prevailing laws and regulations. The company goes on appeal to challenge SEBI's interim order.
- Pending outcome of the adjudications, the Company holds its view of the validity of the nature and effect of the transactions. Accordingly, no adjustments have been made in the financial statements of the Company. Management is in the process of ascertaining the legal position of the Company for the possible cash outflow and its consequential impact on these Standalone and consolidated Financial Statements.
- Figures of Borrowings of Rs. 1132.33 lakhs are subject to confirmation / reconciliation and consequential adjustments thereof. Adjustments in this respect, if any required, would be accounted for as and when ascertained.
- The Company operates in a single segment and in line with Ind AS - 108 "Operating Segments", the operation of the Company fall under only one Business which is considered to be the only reportable business segment.
- The Figures for the quarter ended March 31, 2025 and March 31, 2024 represent the difference between the audited figures in respect of the full financial year and the unaudited published year-to-date figures upto the third quarter of the respective financial year, which were subjected to limited review.
- The figures for the previous period have been regrouped / re-arranged to make them comparable with the current period figures.
- Consolidated audited financial results for the quarter and year ended March 31, 2025 includes results of its subsidiary, Subsidiary Company: Tradetrad Enterprises Private Limited (Formerly Known As Tradetrad Financial Services Private Limited).
- In consolidation, The Group has two reportable business segments (Trading and Real Estate) and it has not provided disclosures required under Ind AS 108 - Operating Segments in respect of segment reporting of material subsidiary to the Group. The Group is under obligation of details as required by Ind AS 108.
- The consolidated audited financial results include the unaudited financial results of Tradetrad Enterprises Private Limited (Formerly Known As Tradetrad Financial Services Private Limited), which has not been reviewed by its auditor and is based on management certified financial statements.

FOR AND ON BEHALF OF BOARD
For: AMBAR PROTEIN INDUSTRIES LIMITED
Sd/-
Pradeep C. Khetani
Managing Director
(DIN: 01786030)

Date: 30/05/2025
Place: Ahmedabad

TIRUPATI SARJAN LTD.
CIN: L5400GJ1993PLC020073

Registered Office: A/11, 12, 13, Satyamev Complex, Opposite Gujarat High Court, S.G. Highway, Ahmedabad 380060
M: 91-79-2766 2013. Web: <http://www.tirupatisarjan.com> Email Id: cs.tirupatisarjan@gmail.com

EXTRACT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2025
(In Lakhs except EPS)

SR. NO.	PARTICULARS	For the quarter ended		For the year ended	
		31/03/2025	31/12/2024	31/03/2024	31/03/2025
1.	Total Income from Operations (net)	7,838.33	5,386.71	7,312.89	22,325.09
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	210.08	198.72	184.29	744.99
3.	Net Profit / (Loss) for the period before tax (after Extraordinary and Extraordinary Items)	210.08	198.72	184.29	744.99
4.	Net Profit / (Loss) for the period after tax (after Extraordinary and Extraordinary Items)	134.53	152.38	89.04	515.52
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	133.97	152.38	89.04	514.96
6.	Equity Share Capital	1,649.90	1,649.90	1,649.90	1,649.90
7.	Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance sheet of previous year)				
8.	Earnings per share (Face value Rs. 10/- each) (for continuing and discontinued operations)				
(a) Basic		0.41	0.46	0.27	1.56
(b) Diluted		0.41	0.46	0.27	1.56

Notes:

- The above results were approved by Audit Committee in its meeting held on 30th May, 2025 and subsequently taken on record by the board of Directors at its meeting held on 30th May, 2025. The company is engaged in business of construction of houses/complexes and also in Government tender work so the sales of tender work has been shown separately. However the segments for AS-17 is only construction activity. 3. Comparative Figures have been regrouped / rearranged wherever necessary. 4. The financial results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other accounting principles generally accepted in India. 5. The company is primarily engaged in construction/Project activities and accordingly this is the only primary reportable segment as per Ind AS 108 - Operating Segment.

Date: 30/05/2025
Place: Ahmedabad

Sd/-: Ruchir Rukhsheshbhai Patel
Whole Time Director
DIN: 03185133

CHANGE OF NAME
I have changed my minor daughter old name from PATEL RASHI RAJENDRABHAI to new name PATEL RASHI RAJENDRABHAI Add: A/401, Apoorvam, Gota, Ahmedabad-38248 861

CHANGE OF NAME
I have changed my old name from DIPIKA VIBULBHAI PATEL to new name DIPIKA VIKULBHAI PATEL Add: 16, Ghanashyamnagar Soc. At: Kunda Tal Kadi Dist. Mehsana 863

WESTERN TIMES
Disclaimer
Advertisement appeared in this News Paper have not been verified factually and "WESTERN TIMES" does not stand responsible for the sales proposition.

CHANGE OF NAME
I have changed my old name from VIBULBHAI GHANSHYAMBHAI PATEL to new name VIKULBHAI GHANSHYAMBHAI PATEL Add: 16, Ghanashyamnagar Soc. At: Kunda Tal Kadi Dist. Mehsana 863A

PUBLIC NOTICE
It is hereby informed to public at large that, Property bearing Memo: Berna, Block/Survey No. 322 Palkhi, House Constructed in Plot No. 8, situated at Berna, within the limits of Berna Gram Panchayat, At & Po: Berna, Tal: Himatnagar, Dist: Sabarkantha, (Land Area Admeasuring 124.875 Sq. Mtrs. (Construction area of 66.50 Sq. Mtrs. and 58.375 Sq. Mtrs. Marginal), is being owned and possessed by Mrs. Geetaben Dilipkumar Raval & Mr. Piyushkumar Kantibhai Prapatti.

Note: On the basis of above-mentioned matter, a Public Notice is being published in the Western Times News Paper (Ahmedabad edition) on dated: 27/05/2025, in which due to typing mistake, name of one of the Owners, Mrs. Geetaben Dilipkumar Raval, was wrongly mentioned as Mrs. Geetaben Dipakumar Raval. This is to inform public at large and kindly read it as Mrs. Geetaben Dilipkumar Raval.

Place: Himatnagar
Date: 01-06-2025

Nishant M. Soni (Advocate)
Add: Office No-FF-125, 1st Floor, Sun Complex, Motipura, Himatnagar, Dist. S.K.(Guj.) 7405629009

PUBLIC NOTICE
I the undersigned Satish V. Patel Advocate Resi. At Godhra is hereby given this public notice by the instruction of my clients,

That (1) Ashokkumar Arjandas Makhiyani had purchased the eastern side 844 sq.mtrs. land out of R. S. No.52 paiki 6/ paiki 1 situated at Village Paravdi, Tal. Godhra, Dist. Panchmahals by registered sale-deed no. 2968, dated 23/03/2021. (2) Ashokkumar Arjandas Makhiyani had purchased the 1669 sq.mtrs. land of R. S. No.52 paiki 5 situated at Village Paravdi, Tal. Godhra, Dist. Panchmahals by registered sale-deed no. 4002, dated 01/06/2021. (3) Sanjaykumar Jethanand Kalvani had purchased the middle side 853 sq.mtrs. land and western side 1660 sq.mtrs. land total 2513 sq.mtrs. land out of R. S. No. 52 paiki 6/ paiki 1 situated at Village Paravdi, Tal. Godhra, Dist. Panchmahals by registered sale-deed no. 7704, dated 02/11/2021. Hence they are owner of the said land. My client has requested me for a Title Clearance Certificate regarding the above all land.

All person / persons or any organization are hereby informed to put in their Claims or interest of objection about the said above referred deed and/or about the said property or any part thereof, within a period of 15 days along with the sufficient evidence from publication of the said notice, failing which claims if any shall be deemed to have been waived.

SATISH V. PATEL
ADVOCATE
Address : 25, Parahans Society, Barroli Road, Al. Godhra-380001, Dist. Panchmahals

WESTERN RAILWAY BHAVNAGAR DIVISION
UPGRADATION OF TOILETS IN NON-AC ICF COACHES

For and on behalf of the President of India Dy. Chief Mechanical Engineer, Carriage Repair Workshop, Bhavnagar Para, Western Railway invites E-tender for below work: E-Tender No. BVPPV-2025-26-RSP-01, Name of the Work: Upgradation of Toilets in Non AC ICF coaches at BVP Workshop as per scope of work. Approximate cost of work: ₹ 22,48,56,715.25/- Bid Security: ₹ 12,74,300/- Tender Document Fees: ₹ 0.00/- Validity of tender offer: 90 Days, Completion Period of work: 12 months from the date of issue of L.O.A. Last date & time for Submission & Opening of tender: 21-06-2025, 10:30 Hrs. and 21-06-2025, 11:00 Hrs. Issued by: Deputy Chief Mechanical Engineer, Office of Chief Workshop Manager, Carriage Repair Workshop, Bhavnagar Para, Western Railway. Email: dcmw@bwp.rail.in Important Note: The tender shall be submitted only Electronically on <https://www.insp.gov.in> and no manual offers are allowed against this E-tender, and any such manual offer received at this office shall be ignored and not opened.

Like us on: www.facebook.com/WesternRail

SANBLUE CORPORATION LTD.
CIN: L15400GJ1993PLC020073

Reg. off: 22-A, Government Servant Soc, Nijumal Market, C.G. Road, Ahmedabad-380009.
Email: inquiry@sanbluecorporation.com Website: www.sanbluecorporation.com

Extract of Financial Results for the Quarter and year ended 31st March, 2025
(Rs. In Lakhs, except per share data)

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended		Previous Year Ended
		31.03.2025	31.12.2024	31.03.2024	31.03.2025	
1.	Total Income	171.03	25.02	142.47	241.66	204.52
2.	Net profit/(loss) for the period/year (before tax, exceptional and/or Extraordinary Items)	-1.95	11.47	-3.13	39.96	34.63
3.	Net profit/(loss) for the period/year (before tax, after exceptional and/or Extraordinary Items)	-1.95	11.47	-3.13	39.96	34.63
4.	Net profit/(loss) for the period/year (after tax, after exceptional and/or Extraordinary Items)	-1.95	16.05	-2.37	32.96	25.33
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-1555.04	648.22	-843.55	-369.12	1567.61
6.	Paid Up Equity Share Capital	499.96	499.96	499.96	499.96	499.96
7.	Other Equity	-	-	-	4777.16	5146.28
8.	Security Premium Account	-	-	-	-	-
9.	Basic & Diluted	-0.03	0.32	-0.04	0.66	0.51

Notes:

The Full Form of the quarterly/Yearly Financial Results is available on the website of the Company and Bombay Stock Exchange at <https://www.sanbluecorporation.com/financial-results.html> & <https://www.bseindia.com> stock-share-price/sanblue-corporation-india/sanblue-521222/ respectively, and the said financial results can also be accessed by scanning a Quick Response (QR) code given below:

For and on behalf of the Board of Directors
Sanblue Corporation Limited
Sd/-
Jekil Pancholi - Company Secretary - FCS: 12329

Place: Ahmedabad
Date: 30th May, 2025

ડાકોર : રમકડાના ગોડાઉનમાં
આગ લાગતા અફડા તફડી મચી

(પ્રતિનિધિ) નડિયાદ,

ડાકોરમાં પોલીસ સ્ટેશનની સામે આવેલી પુનમ ગેસ્ટ હાઉસ વાળા કોમ્પલેક્સની રમકડા ના એક ગોડાઉનમાં આગે બપોરે આગ લાગતા અફડા તફડી મચી હતી. આ બનાવની જાણ ડાકોર પાલિકાના કાયદર ફાઇટરને કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા અને આગ ને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો જો કે આગ વધુ ફેલાઈ ગઈ હોય કારણકી કાયદર ફાઇટર બોલાવવા પડ્યા હતા અને આગ કાબુલ લેવામાં પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે આ આગમાં લાખોનો માલ ખામ થયો હોવાની શંકાવા સેવાઈ રહી છે. આ અંગે મળતી માહિતી મુજબ ડાકોરમાં પોલીસ સ્ટેશનની સામે પુનમ ગેસ્ટ હાઉસ વાળા કોમ્પલેક્સમાં એક રમકડા ગોડાઉન આવેલું છે આ રમકડાના ગોડાઉનમાં એક બપોરે અકાએક આગ લાગી હતી પ્રાથમિક તપાસ મુજબ શોટ સંક્રિંતા કારણે આગ લાગી હોય તેવી શંકાવાઓ સંભળી રહી છે રમકડા ગોડાઉન હોય પ્લાસ્ટિકનો સામાન હતું એટલે આગ તરત વધુ પસંદી ગઈ હતી એટલે થુપાસના ગોડાઉની નીકળવા લાગ્યા હતા જે ત્રણ ચાર કિલોમીટર દૂરથી દેખાતા હતા.

રાજકોટની તક્ષશિલા સોસાયટીમાં
આઠ લોકોને કોરોના થયો

(એજન્સી) રાજકોટ,

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઈન-પ્રતિદિન બપોરે થઈ રહ્યો છે. એક ધડી એક કોરોનાવારુ કેસ સામે આવતા તરત પાલુ એલર્ટ માંડ પર આવી ગયું છે. રાજકોટમાં કોરોના કેસમાં સતત બપોરે રહ્યો છે. તમિલિલા સોસાયટીમાં એક સાથે ૮ લોકો કોરોના પોઝિટિવ આવતા હડપ્પ મચી જવા પામ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ સોસાયટીની મુલાકાત લીધી હતી.

રાજકોટમાં કોરોનાના રાકડો ફાટતા તરત એલર્ટ માંડ પર આવી ગયું છે. તમિલિલા સોસાયટીમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે.

સોસાયટીમાં એક સાથે ૮

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં
પાકિસ્તાની એક મહિલા ઝડપાઈ

(એજન્સી) અમદાવાદ,

અમદાવાદમાં પાકિસ્તાની મહિલા ઝડપાઈ છે. શારદાબેન હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા પાકિસ્તાન તેને ભાંડો ફેંચ્યો હતો. મહિલાએ દાખલ થવા માંધારકાર્ડના બદલે પાસપોર્ટ આપ્યો હતો. હોસ્પિટલમાં પાસપોર્ટ આપતા તે પાકિસ્તાની મહિલા હોવાનું ખુલ્લું હતું. મહિલાના વિગ્ર માર્ચ મહિનામાં પૂર્ણ થયો હોવાનો ખુલાસો હતો તેથી તેને હાલ અમદાવાદમાં અટકાવી રાખવામાં આવી છે. મહિલા અંગે હોસ્પિટલ તરફે શોધ થયો છે એ વચ્ચે કરી ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાંથી એક પાકિસ્તાની મહિલાને ઝડપી

પાસપોર્ટ આવી છે. આ મહિલા શારદાબેન હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા આવી હતી આ દરમિયાન પાકિસ્તાન તેને ભાંડો ફેંચ્યો હતો. દાખલ થવા માંધારકાર્ડના બદલે પાસપોર્ટ આપ્યો હતો. હોસ્પિટલમાં પાસપોર્ટ આપતા તે પાકિસ્તાની મહિલા હોવાનું ખુલ્લું હતું. મહિલાના વિગ્ર માર્ચ મહિનામાં પૂર્ણ થયો હોવાનો ખુલાસો હતો તેથી તેને હાલ અમદાવાદમાં અટકાવી રાખવામાં આવી છે. મહિલા અંગે હોસ્પિટલ તરફે શોધ થયો છે એ વચ્ચે કરી ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાંથી એક પાકિસ્તાની મહિલાને ઝડપી

ADARSH PLANT PROTECT LIMITED					
Rgt. Office : 604, GDC, VITTHAL UDYOGNAGAR - 388 121, DIST. ANAND					
CIN No. L32100GJ1992PLC017640			Website : www.adarshplant.com		
Tel No. 026923 236705			Fax No. (02692) 236704 Email ID: adarshplantprotect@gmail.com		
(Rs. In lakhs)					
Extract of Audited Financial Results for the quarter and year ended 31st March, 2025					
Sr. No.	Particulars	Quarter ended	Quarter ended	Quarter ended	Year ended
		31.03.2025	31.03.2024	31.03.2024	31.03.2024
		Audited	Un-audited	Audited	Audited
1	Total Income from Operations	442.30	383.91	546.52	1750.65
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	-127.67	0.74	23.21	-111.89
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	-127.67	0.74	23.21	-111.89
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	-127.67	0.74	23.21	-111.89
5	Total Comprehensive Income for the period	-127.67	0.74	23.21	-111.89
6	Equity Share Capital	991.15	991.15	991.15	991.15
7	Earnings per share (Face Value of Rs. 10/- each)				
	a. Basic	-1.29	0.01	0.23	-1.13
	b. Diluted	-1.29	0.01	0.23	-1.13
NOTES:					
1. The above is an extract of the detailed format of Quarterly/Audited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015.					
2. The full format of the Audited Financial Results are available on the website of the Stock Exchange www.bseindia.com and on the website of the Company www.adarshplant.com.					
3. The said results were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors in their meeting held on 30th May, 2025.					
4. Previous period's figures have been regrouped/reclassified whenever required.					
For Adarsh Plant Protect Limited					
Sd/-					
Mr. Ansh N. Patel					
Managing Director (DIN: 00084015)					
Place: V. U. Nagar					
Date: 30.05.2025					

AMBAR PROTEIN INDUSTRIES LIMITED				
(CIN: L35400GJ1992PLC018758)				
(Regd. Off: Sarkhej-Bavla Highway, Opp Bhagydaj Hotel, Changodar, Dist. Ahmedabad-382213)				
E-mail: ambarinvg@gmail.com • Website: www.ambarprotein.com				
Contact No: (02717) 250220 / 221 / 410 • F: (02717) 297123				
EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31 ST MARCH, 2025				
(Rs. In Lacs)				
Particulars	Quarter Ended	Quarter Ended	Year Ended	Year Ended
	31-03-25	31-03-24	31-03-25	31-03-24
Audited		Audited	Audited	Audited
Total Income from Operations (Net)	12780.87	8950.53	42162.3	
Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	319.70	(128.16)	1303.11	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	319.70	(128.16)	1303.11	
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	248.47	(45.40)	965.02	
Total Comprehensive Income for the period (Comprising profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	249.33	(46.83)	965.66	
Equity Share Capital	575	575	575	
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of the Previous Year)	-	-	-	
Earning Per Share (of Rs. 10/- each) (For Continuing and discontinued Operations)				
(a) Basic	4.34	(0.81)	16.79	
(b) Diluted	4.34	(0.81)	16.79	
Note:				
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Company (www.ambarprotein.com) and on the website of BSE Ltd. (www.bseindia.com).				
2. The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.				
3. Exceptional and/or Extraordinary Items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.				
For and on behalf of Board				
Date : 30-05-2025				
Place : Ahmedabad				
Pradeep C. Khetani				
Managing Director				
(DIN : 91786030)				

TIRUPATI SARJAN LTD.

CIN:L45100GJ1995PLC024091

Registered Office: A/11, 12, 13, Satyamev Complex, Opposite Gujarat High court, S.G. Highway, Ahmedabad 380060

M : 91-79-2766 2013.Web: http://www.tirupatisarjan.com Email id: cs.tirupatisarjan@gmail.com

EXTRACT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2025

(In lacs except eps)

SR. NO.	PARTICULARS	For the quarter ended			For the year ended	
		31/03/2025	31/12/2024	31/3/2025	31/3/2025	31/3/2024
		Audited	Unaudited	Audited	Audited	Audited
1	Total Income from Operations (net)	7,838.33	5,386.71	7,312.89	22,325.09	19,525.86
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	210.08	198.72	184.29	744.99	604.93
3	Net Profit / (Loss) for the period before tax (after Extraordinary and/or Extraordinary Items)	210.08	198.72	184.29	744.99	604.93
4	Net Profit / (Loss) for the period after tax(after Extraordinary and/or Extraordinary Items)	134.53	152.38	89.04	515.52	394.85
5	Total Comprehensive Income for the period (Comprising Profit/Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)	133.97	152.38	89.04	514.96	394.85
6	Equity Share Capital	1,649.90	1,649.90	1,649.90	1,649.90	1,649.90
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance sheet of previous year)				7,272.66	6,757.71
8	Earning per share (Face value Rs. 10/- each) (for continuing and discontinued operations)					
	(a) Basic	0.41	0.46	0.27	1.56	1.20
	(b) Diluted	0.41	0.46	0.44	1.56	1.59

Notes:

1. The above results were approved by Audit Committee in its meeting held on 30th May, 2025 and subsequently taken on record by the board of Directors at its meeting held on 30th May, 2025. 2. The company is engaged in business of construction of houses/complexes and also in Government tender work so the sales of tender work has been shown separately. However the segments for AS-17 is only construction activity. 3. Comparative Figures have been regrouped & rearranged wherever necessary. 4. The financial results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 & 4 - (Ind-AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other accounting principles generally accepted in India 5. The company is primarily engaged in construction/Project activities and accordingly this is the only primary reportable segment as per Ind AS 108- Operating Segment.

Date : 30/05/2025

Place : Ahmedabad

વેસ્ટર્ન રાઇઝર્સ
વેસ્ટર્ન રાઇઝર્સ પ્રકાશિત
જ્ઞાપરતો અંગે વાંચકોએ
પોનાની રીતે યક્ષાસ્રી કરી
નિષ્ફળ લેવો.

-જાહેરખબર મેનેજર

જન્મ દિવસની શુભેચ્છા



વિનોદ રાહો

જાણી લેજો મેનેજિંગ એડિટર,

વંદે ગુજરાત

સાનબ્લુ કોર્પોરેશન લિમિટેડ						
CIN: L15400GJ1993PLC020073						
રજી. ઓફિસ : ૨૨ - ઓ, ગાંધીનંદ સર્વલ્લ સોસાયટી, મુનિસિપલ માર્કેટ પાસે, સી.જી. રોડ, અમદાવાદ-૩૮૦૦૦૬ Email : inquiry@sanbluecorporation.com • Website: www.sanbluecorporation.com						
૩૧ માર્ચ ૨૦૨૫ના રોજ પૂર્ણ થયેલો ફિનાન્સિયલ અને વાર્ષિક નાણાકીય પરિણામોનો સારાંશ						
(૨૨ કરોડ માહિતી સિવાય, રૂ. લાખમાં)						
અંક	વિવરણ	ફિનાન્સિયલ ગણના		વાર્ષિક ગણના		અગાઉના વર્ષ
		અગાઉના વર્ષ	અગાઉના વર્ષ	અગાઉના વર્ષ	અગાઉના વર્ષ	અગાઉના વર્ષ
૧	કુલ આવક	૩૧.૦૩.૨૦૨૫	૩૧.૧૨.૨૦૨૪	૩૧.૦૩.૨૦૨૫	૩૧.૦૩.૨૦૨૪	૩૧.૦૩.૨૦૨૪
૨	કોમ્પ્રિહેન્સિવ પ્રોફિટ/લોસ (સામાન્ય વાણિજ્ય વાણિજ્ય)	-૧.૬૫	૧૧.૪૭	-૩.૧૩	૩૬.૬૯	૩૪.૬૩
૩	કોમ્પ્રિહેન્સિવ પ્રોફિટ/લોસ (સામાન્ય વાણિજ્ય વાણિજ્ય)	-૧.૬૫	૧૧.૪૭	-૩.૧૩	૩૬.૬૯	૩૪.૬૩
૪	કોમ્પ્રિહેન્સિવ પ્રોફિટ/લોસ (સામાન્ય વાણિજ્ય વાણિજ્ય)	-૧.૬૫	૧૧.૪૭	-૩.૧૩	૩૬.૬૯	૩૪.૬૩
૫	કોમ્પ્રિહેન્સિવ પ્રોફિટ/લોસ (સામાન્ય વાણિજ્ય વાણિજ્ય)	-૧.૬૫	૧૧.૪૭	-૩.૧૩	૩૬.૬૯	૩૪.૬૩
૬	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-૧૫૫૫.૦૪	૬૪૮.૨૨	-૮૪૩.૫૧	-૩૫૬.૧૨	૧૫૫૫.૦૪
૭	કુલ આવક બાદના અગાઉના વર્ષ	૪૬૮.૬૯	૪૬૮.૬૯	૪૬૮.૬૯	૪૬૮.૬૯	૪૬૮.૬૯
૮	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૯	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૧૦	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૧૧	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૧૨	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૧૩	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૧૪	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૧૫	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૧૬	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૧૭	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૧૮	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૧૯	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૨૦	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૨૧	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૨૨	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૨૩	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૨૪	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૨૫	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૨૬	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૨૭	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૨૮	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૨૯	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૩૦	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૩૧	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૩૨	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૩૩	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૩૪	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૩૫	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૩૬	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૩૭	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૩૮	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૩૯	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૪૦	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૪૧	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૪૨	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૪૩	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૪૪	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૪૫	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૪૬	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૪૭	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૪૮	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૪૯	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૫૦	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૫૧	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૫૨	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૫૩	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૫૪	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૫૫	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૫૬	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૫૭	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૫૮	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૫૯	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૬૦	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૬૧	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૬૨	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૬૩	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૬૪	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૬૫	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૬૬	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૬૭	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૬૮	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૬૯	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૭૦	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૭૧	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૭૨	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૭૩	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૭૪	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૭૫	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૭૬	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૭૭	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૭૮	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૭૯	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૮૦	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૮૧	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૮૨	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૮૩	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૮૪	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૮૫	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૮૬	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૮૭	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૮૮	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૮૯	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૯૦	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૯૧	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૯૨	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૯૩	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૯૪	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૯૫	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૯૬	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૯૭	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૯૮	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૯૯	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-
૧૦૦	કુલ આવક બાદના અગાઉના વર્ષ	-	-	-	-	-

નોંધ: (અ) ઉપરોક્ત નિર્વાસિત/વાર્ષિક નાણાકીય પરિણામોનું સંપૂર્ણ સ્વરૂપ ડૅપીની રેવેન્યુઝ <https://www.sanbluecorporation.com/financials-reserved.html> અને એન એચ સી રોકડ અસંગતે ડૅપીની રેવેન્યુઝ <https://www.bseindia.com/stock-share-profile/sanblue-corporation/121222/> પર ઉપલબ્ધ છે. એન એચ આપેલ ફિક્સ રિસેન્સ (DR) ડોલર અને ડૅપીની રેવેન્યુઝ નાણાકીય પરિણામો પાસે અસંગત સી રક્ષાય છે.

૦૧૦૮ અને ૬૬૨૦૨૬ અને અને વતી,
સાનબ્લુ કોર્પોરેશન લિમિટેડ

Sd./

જેલિન કોરેશન - ડૅપીની રેવેન્યુઝ - FCS: 12322

સંચાલક : અમદાવાદ
તારીખ : ૩૦ મે, ૨૦૨૫

